



ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ  
છબ્બે માળ, ગિફ્ટ વન, માર્ગ-પ-સી, ઝોન-પ,  
ગિફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨૩૫૫, ગુજરાત

### જાહેર નોટીસ

પવન ઊર્જા વિજ મથકો મથકોમાંથી વિતરણ પરવાનેદારો તેમજ અન્ય દ્વારા વિજ પ્રાપ્તિ ના શુલ્ક હુકમ નંર ૨/૨૦૧૩ તથા હુકમ અરજી નં. ૧૨૪૩/૨૦૧૨ તથા ૧૨૪૯/૨૦૧૨ તારીખ ૭.૦૧.૨૦૧૩ થકી નિર્ણીત નો સમયગાળો આયોગ આગામી સમયગાળા માટે શુલ્ક નક્કી કરતો હુકમ બહાર પાડે ત્યાં સુધી લંબાવવા બાબતે.

આયોગે પવન ઊર્જા ઉત્પાદકો તથા વિતરણ પરવાનેદારો પાસેથી પવન ઊર્જા ખરીદવા માટે શુલ્ક નક્કી કરવા માટેના હુકમ નં. ૨/૨૦૧૨ તારીખ ૮.૦૮.૨૦૧૨ તથા હુકમ અરજી નં. ૧૨૪૩/૨૦૧૨ તથા ૧૨૪૯/૨૦૧૨ તારીખ ૭.૦૧.૨૦૧૩ની રોજ પસાર કરેલ છે. આ હુકમ નો નિયંત્રણ સમયગાળો ૧૧.૦૮.૨૦૧૨ થી ૩૧.૦૩.૨૦૧૬ છે.

સંલગ્ન પવન ઊર્જા ખરીદવા માટે શુલ્ક નક્કી કરવા માટે આયોગે આગામી નિયંત્રણ સમયગાળા માટેની ચર્ચાપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે, કે જે પ્રક્રિયા પૂરી કરવામાં અમુક સમય લાગી શકે તેમ છે. તેથી ઉપરોક્ત હુકમ ને ધ્યાને લઈ આયોગ વચગાળાની વ્યવસ્થા તરીકે પવન ઊર્જા ઉત્પાદકો તથા વિતરણ પરવાનેદારો દ્વારા પવન ઊર્જા ખરીદવા માટે શુલ્ક નક્કી કરવા માટેના હુકમ નં. ૨/૨૦૧૨ તારીખ ૮.૦૮.૨૦૧૨ નો નિયંત્રણ સમયગાળો આગામી વીજળી પ્રાપ્તિના શુલ્ક નો હુકમ નક્કી કરવા સુધી લંબાવવા માટે સુચિત કરે છે. ઉપરોક્ત પ્રક્રિયા ને ધ્યાને લઈ આયોગ દ્વારા આયોગ દ્વારા સ્વયં અરજી નં ૧૫૬૪/૨૦૧૬ શરૂ કરાઈ છે. જે આયોગની વેબ સાઇટ ([www.gercin.org](http://www.gercin.org)) ઉપર વાંધા/સૂચનો મંગાવવા અર્થે મુકવામાં આવે છે.

ઉપરની સ્વયં કરાયેલી અરજી સંબંધમાં જેમને તેમના વાંધા/સૂચનો રજૂ કરવામાં રસ હોય તેવી વ્યક્તિઓ, તેઓ જેના પર આધાર રાખવા માગતા હોય તેમને આથી જાણ કરવામાં આવે છે કે ઉપરની સ્વયં કરાયેલી અરજી સંબંધમાં જેમને તેમના વાંધા/સૂચનો રજૂ કરવામાં રસ હોય તેવી વ્યક્તિઓ, તેઓ જેના પર આધાર રાખવા માગતા હોય તે એફિડેવિટથી યોગ્ય રીતે સમર્થિત દસ્તાવેજોની પાંચ નકલ સાથે સાથે તા. ૧૦/૦૪/૨૦૧૬ પહેલાં સચિવશ્રી, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, છબ્બે માળ, ગિફ્ટ વન, માર્ગ-પ-સી, ઝોન-પ, ગિફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨૦૩૫૫, ગુજરાતને રજૂ કરી શકશે અને તેઓને રૂબરૂમાં સાંભળે તેમ તેઓ ઇચ્છે કે કેમ તે પણ તેમાં દર્શાવે. સ્વયં કરાયેલી અરજી નં. ૧૫૬૪/૨૦૧૬ માટેની સુનાવણીની તારીખ ૧૯/૦૪/૨૦૧૬ના રોજ ૧૧:૩૦ વાગ્યે નક્કી કરી છે. રસ ધરાવતી વ્યક્તિઓના સંદર્ભ માટે સ્વયં અરજી (Suo-Motu Petition) ની નકલ તેનાં જોડાણો સાથે તપાસવા આયોગની કચેરીમાં ઉપલબ્ધ છે.

સહી/-  
(રૂપવંત સિંહ, આઇ.એ.એસ)  
સચિવ  
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ

સ્થળ : ગાંધીનગર  
તારીખ : ૨૨/૦૩/૨૦૧૬.